



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૨/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૮૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૯ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૮૯ લીટર દેશી દારૂ, ૧૨૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૦૬ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ અને ૨૬ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૨૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૯,૮૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૮૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૩૮૬/૧૯

**સરખેજ:** મનોજ અશોકભાઈ હાવાની (રહે. પુનીતનગર વિભાગ-૩ મેડીકીક હોસ્પિટલ પાસે સેટેલાઈટ) એ તા.૨૭/૨/૧૯ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૨/૧૯ રાતના ૯/૦૦ થી તા.૨૬/૨/૧૯ સાંજના ૫/૦૦ વાગ્યા દરમિયાન સરખેજ લાલજી નુલજી ટ્રાન્સપોર્ટ પાછળ સહજાનંદ એસ્ટેટ દુકાન નં.-૧૯૧ ની ઓફીસની બારીની ગ્રીલ તોડી અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી સોના-ચાંદીના સિક્કા નં-૧૨૩ કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૫,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૧૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ ઇન્ચાર્જ પો.ઈ.શ્રી એલ.ડી.ખોડેદરા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૩૮૭/૧૯

**સેટેલાઈટ:** ભાર્ગવભાઈ પ્રવિણભાઈ પટેલ (ઉ.વ.૩૮) (રહે.ઓશીયન કોલોની પ્રગતીનગર નારણપુરા) એ તા.૨૭/૨/૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૨/૧૯ સાંજના ૫/૪૫ વાગ્યાના સુમારે આરોપી ધુવકુમાર કેરલભાઈ પટેલ (જેના પુરા સરનામાની ખબર નથી) સેટેલાઈટ શીવરંજની તનિષ્ઠ જવેલર્સ શો રૂમમાંથી સેલ પર્સનની નજર ચુકવી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૧,૩૧,૦૦૦/- ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.જે.ઝાલા ચલાવે છે.

**રામોલ:** ચંદ્રકાંત વિશ્વનાથ પાટીલ (રહે:શરણમ પેરેડાઈઝ રીલાઈન્સ પેટ્રોલપંપ પાછળ વસ્ત્રાલ) એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૨/૧૯ કલાક ૪/૦૦ વાગ્યાના સુમારે ચંદ્રકાંત પાટીલના જમાઈ અને પુત્રી શટલ ઓટોરિક્ષામાં બેસી પોતાના ઘર નજીક આવ્યા હતા ત્યારે રહેણાંક નજીક રિક્ષામાંથી ઉતર્યા બાદ ચંદ્રકાંત પાટીલના જમાઈ અને પુત્રી પાસેથી રિક્ષા ભાડુ લીધા વિના આ રિક્ષા ચાલક રિક્ષા લઈ ભાગી ગયો હતો. રિક્ષામાં ચંદ્રકાંત પાટીલના જમાઈ અને પુત્રીનો થેલો હતો. જે થેલામાં (૧) સોનાનુ મંગળસુત્ર કિંમત રૂપિયા ૬૦,૦૦૦/-, (૨) કાનની બુટી જોડી-૧ કિંમત રૂપિયા ૮૦૦૦/- (૩) સોનાની વીટીઓ નંગ-૩ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-, (૪) નાકની નથ કિંમત રૂપિયા ૧૫૦૦/- (૫) ઓપો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/- (૬) કપડા કિંમત રૂપિયા ૫૦૦૦/- અને (૭) કટલરીનો અલગ અલગ સામાન કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૯૯,૫૦૦/- મતા હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.બી.વાઘેલા ચલાવે છે.

**લુંટની ફરીયાદ:-**

**સમાચાર યાદી નં.૩૮૮/૧૯**

**સરદારનગર:** ધનશ્યામભાઈ કનૈયાલાલ બદલાણી (ઉ.વ.૭૪) (રહે.મહારાજા બંડ્લોજ સીંધી હોસ્પીટલની બાજુમા માયા સીનેમા રોડ કુબેરનગર સરદારનગર) તા.૨૬/૨/૧૯ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે નોબલનગર નિરંકારી આશ્રમભવન સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ધનશ્યામભાઈ બદલાણીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ધનશ્યામભાઈ બદલાણીએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.કે.ભટ્ટ ચલાવે છે.

**ઇસનપુર:** રાજેશભાઈ કેલાસચંદ્ર મીણા (ઉ.વ.૩૦) (રહે. માતૃભુમી સોસાયટી અયોધ્યાનગરની બાજુમા બરોડા એક્સપ્રેસ હાઇવે પાસે સી.ટી.એમ.) તા.૨૭/૨/૧૯ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે રાજેશભાઈ મીણાના ભાભી કિરણબહેન દિનેશકુમાર મીણા નાઓ ઇસનપુર આવકાર હોલ કેનાલ પાસે આવેલ અમુલ પાર્લર પાસે મંગલેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રાજેશભાઈના ભાભી કિરણબહેનના ગળામાંથી સોનાનુ મંગળસુત્ર કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રાજેશભાઈ મીણાએ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.જી.જલવાણી ચલાવે છે.

**અપમૃત્યુ:-**

**સમાચાર યાદી નં.૩૮૯/૧૯**

**દાણીલીમડા:** દાણીલીમડા અર્શ ટેક્ષટાઇલ કંપનીમા રહેતા અને ત્યાજ કામ કરતા પ્રવિણભાઈ કાળુભાઈ તલાર (ઉ.વ.૫૩) (મુળ વતન :- ગામ: ચાર્ણ સાલાવાડા તા. લુનાવાલા જી. મહીસાગર) તા.૨૭/૨/૧૯ કલાક ૦૦/૩૦ વાગ્યા પહેલા અર્શ ટેક્ષટાઇલ કંપનીમાં ખાતે કાપડનુ ફોલ્ડીંગ કામ કરતા હતા ત્યારે કાપડની થપ્પી તેના ઉપર પડતા નીચે દબાઈ જતા તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ. શ્રી સોહાબખાન અઝીઝખાન ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.